

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૬/૦૪/૨૦૧૬ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૭૦૪/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૧ કેસ કરી, ૧૬ વ્યક્તિઓને ઝડપી ૧૦૮ લીટર દેશી દારૂ દારૂ કબજે કર્યો હતો.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૭૦૫/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૧૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

અપહરણની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૭૦૬/૧૬

શાહીબાગ: ભારતીબહેન વિનોદભાઈ પટ્ટણી (ઉ.વ.૧૫) (રહે.બળીયાદેવના ટેકરાના છાપરા, મંગલપાન્ડે હોલની સામે પંચવટી ચાર માળીયા ઓઢવ) ને તા.૧૩/૪/૧૬ બપોરના ૧૨/૩૦ વાગ્યાના સુમારે ઘર નજીક રહેતો આરોપી આકાશ પ્રિતમભાઈ શાહીબાગ અસારવા, બાલભારતી સ્કુલ સામે ચમનપુરા પંમ્પીંગ સ્ટેશનના કમ્પાઉન્ડ નજીકથી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે ભગાડી લઈ ગયો છે. આ અંગેની ફરીયાદ ભારતીબહેનના પિતા વિનોદભાઈ પટ્ટણીએ તા.૧૫/૪/૧૬ નારોજ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી કે.કે.દેસાઈ ચલાવે છે.

સરદારનગર: રોશનીબહેન છગનભાઈ ઓડ (ઉ.વ.૧૪) (રહે.રમેશદત્ત કોલોની ભીલવાસ સરદારનગર) ને તા.૩૧/૩/૧૬ કલાક ૮/૦૦ વાગ્યાના સુમારે ઘર નજીક રહેતો આરોપી વિજય દયારામ કોળી આશ્રય બંગલોઝ નજીકથી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે ભગાડી લઈ ગયો છે. આ અંગેની ફરીયાદ રોશનીબહેનની માતા લીલાબહેન ઓડએ તા.૧૫/૪/૧૬ નારોજ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી વી આર પટેલ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૭૦૭/૧૬

બાપુનગર: પ્રદિપભાઈ રણછોડભાઈ પટેલ (રહે. શકિત ફ્લેટ ગુજરાત હાઉસીંગ બોર્ડ હરીભાઈ ફાફડા વાળાની સામે બાપુનગર) એ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા ૧૪/૪/૧૬ રાતના ૮/૦૦ થી તા.૧૫/૪/૧૬ સવારના ૭/૧૫ વાગ્યા દરમિયાન પોતાના મકાનના રસોડાના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી તિજોરી માંથી સોનાનું મંગળસુત્ર કિંમત રૂપિયા ૩૦૦૦૦/-, સોનાની વીંટી કિંમત રૂપિયા ૭૦૦૦/- અને રોકડ રૂપિયા ૨,૧૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨,૪૭,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એસ.એ.પટેલ ચલાવે છે.

વાહનચોરી:-

સમાચાર યાદી નં.૭૦૮/૧૬

ગાયકવાડ હવેલી: યુસુફખાન અબ્દુલાહખાન પઠાણ (રહે.ભોઈવાડો બેચરઘાંચીના ડેલાની બાજુમાં જમાલપુર) એ તા ૧૦/૪/૧૬ બપોરના ૩/૩૦ વાગે જમાલપુર દરવાજા મ્યુ.શાળા સામે પોતાની ઓટોરિક્ષા નંબર જીજે ૧ ડીવાય ૮૬૮૯ કિમત રૂપિયા ૯૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી એક કલાકમાં થઈ હતી. આ અંગેની ફરીયાદ યુસુફખાન પઠાણે તા.૧૫/૪/૧૬ નારોજ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી વી યુ પાડવી ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૭૦૯/૧૬

એલીસબ્રીજ: અશોકભાઈ ભગવાનદાસ મકવાણા (ઉ.વ.૪૦) (રહે.આંબેડકર કોલોની આંબાવાડી) એ કોઈ કારણસર તા.૧૪/૪/૧૬ કલાક ૧૧/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે વા.સા.હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન રાતના ૧૧/૪૫ વાગે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે એલીસબ્રીજ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી ડી ડી વસાવા ચલાવે છે.

શહેરકોટડા: અરવિંદભાઈ અશોકભાઈ પટણી (ઉ.વ.૨૦) (રહે.બોરડીવડનગરના છાપરાં ભગવતીનગરની સામે પંડીતનગરની બાજુમાં સરસપુર) એ કોઈ કારણસર તા.૧૪/૪/૧૬ રાતના ૮/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી વાલસંગભાઈ મલાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.